

તા.-૧૬/૦૪/૨૦૧૫ ના રોજ ગાંધીનગર જિલ્લા ખાતે કરવામાં આવેલ બેઠકની સંક્ષિપ્ત નોંધ

માન. મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યનાં વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને રાજ્યના બાળકોના પોષણની સ્થિતિ અંગે ચિંતા સેવી રહ્યા છે. આ સંદર્ભમાં માન. કમિશ્નર વ અગ્ર સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ દ્વારા બાળકોના કુપોષણને દૂર કરવા સઘન ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. આ ઝૂંબેશના ભાગરૂપે જિલ્લા કક્ષાએ આયોજન અને સમીક્ષા બેઠક કરવામાં આવેલ છે.

કુપોષણ સામેની ઝૂંબેશની કામગીરી અને આઈસીડીએસની સેવાઓને વધુ સુદ્રઢ કરવા માટે તા.-૧૬/૦૪/૨૦૧૫ ના રોજ માન. કમિશ્નર વ અગ્ર સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ દ્વારા ગાંધીનગર જિલ્લાની મુલાકાત કરી આયોજન અને સમીક્ષા બેઠક કરવામાં આવેલ.



આ બેઠકમાં મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, આરોગ્ય અને આઈસીડીએસના જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ, તમામ સીડીપીઓશ્રી, બ્લોક કો-ઓર્ડિનેટરશ્રીઓ અને આંગણવાડી તાલીમ કેન્દ્રના પ્રતિનિધિશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગર જિલ્લા તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૭૮ બાળકોના પોષણ સ્તરમાં સુધારો થયેલ છે. ઉપરાંત ૧૧ આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા, ૧૦ આંગણવાડી કેન્દ્રોમાં પાણીની સુવિધા અને ૩ આંગણવાડી કેન્દ્રોમાં વીજળીની સુવિધા અપાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

બેઠકમાં મુખ્યત્વે બાળકોના કુપોષણને દૂર કરવા તથા આઇસીડીએસની સેવાઓને વધુ સુદ્રઢ કરવા માટે નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરી સૂચનાઓ આપવામાં આવી હતી-

- જીલ્લા દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા.
- જિલ્લાનું આગામી કામગીરીના આયોજનની ચર્ચા.
- તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરી, ઓછા વજનવાળા, અતિઓછા વજનવાળા અને તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોની યાદી અલગ તારવવાની સૂચના આપવામાં આવી.
- ઓછા વજનવાળા, અતિઓછા વજનવાળા બાળકોને ઘનિષ્ઠ પોષણ અભિયાન અંતર્ગત તથા તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને બાળ સંજીવની કેન્દ્ર અને બાળ સેવા કેન્દ્ર ખાતે મોકલવા માટેના આયોજનની ચર્ચા.
- આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને જરૂરિયાત પ્રમાણે ઓછા વજનવાળા બાળકોને મલ્ટી વિટામિન, બી કોમ્પ્લેક્ષ, આલ્બેન્ડાઝોલ અને આયર્ન સીરપ આપવા અંગે સૂચના આપી.
- તમામ ઓછા અને અતિ ઓછા વજનવાળા બાળકોની આરોગ્ય અને પોષણની સ્થિતિ જાણી શકાય તે માટે તેવા તમામ બાળકોની પ્રોફાઇલ બનાવવાની સૂચના આપી.
- વાડી વિસ્તારમાં રહેતા ઓછા વજનવાળા બાળકોને લોકભાગીદારીથી ખજૂર, સુખડી, મગસ જેવા પૌષ્ટિક આહાર આપવા પ્રયાસ કરવા જણાવ્યું.
- આંગણવાડી કેન્દ્રોની મુલાકાત અને બાળકોના વજન કરી ચકાસણી કરવાની સૂચના આપી.
- ગૃહ-મુલાકાત, પોષણ સભા અને વાલીઓ સાથે સંપરામર્શ કરવાની બાબત ઉપર ભાર મુકવામાં આવ્યો.
- પ્રચાર પ્રસારની કામગીરી વધુ સઘન બનાવવા સૂચના આપી કે જેથી તમામ લોકો સુધી આઇસીડીએસની સેવાઓની માહિતી પહોંચાડી શકાય.
- દરેક જિલ્લાઓમાં સુપરવાઇઝરને નિયત કરેલ દિવસો પ્રમાણે આંગણવાડીની મુલાકાત ફરજિયાત લેવી. ઘટક કક્ષાએ મુખ્યસેવિકાઓ દ્વારા કરેલ કામગીરીનું સઘન મોનીટરીંગ કરવું.
- આંગણવાડી કાર્યકર, તેડાગર અને સુપરવાઇઝરની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે સૂચના આપી.
- અમલીકરણની પ્રગતિ માટે દર પખવાડિયે સમીક્ષા બેઠક કરવા સૂચન કરેલ.

ઉપરોક્ત બેઠકમાં ચર્ચાચેલ મુદ્દાઓના આધારે કુપોષણ સામેની ઝૂંબેશની કામગીરી અને આઇસીડીએસની સેવાઓને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય કક્ષાએથી નીચે મુજબના પગલાં લેવામાં આવેલ છે-

- તમામ અધિકારીશ્રી/ કર્મચારીશ્રી અને કન્સલટન્ટશ્રીઓ દ્વારા સઘન મોનિટરિંગ અને સપોર્ટિવ સુપરવિઝન માટે જિલ્લાઓની ડાળવણી કરવામાં આવી અને દર મહિને નિયમિત રીતે વિઝિટ કરવાની સૂચના આપવામાં આવી. તેમજ તેઓ દ્વારા કરેલ મુલાકાતની સમીક્ષા માન. કમિશ્નરશ્રી વ અગ્ર સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ દ્વારા કરવામાં આવે છે.
- પ્રાયોરિટિવાળા જિલ્લાઓની મુલાકાત માટે એક અલગ ટીમ બનાવી દર મહિને નિયમિત રીતે વિઝિટ કરવામાં આવે છે.
- તમામ અધિકારીશ્રી/ કર્મચારીશ્રી અને કન્સલટન્ટશ્રીઓ દ્વારા તેઓના સોંપેલ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત બાદ વિઝિટ દરમિયાન જોવા મળેલ સારી બાબતો તેમજ ક્ષતિઓને દૂર કરવાની ચર્ચા સેજા અને ઘટક કક્ષાની મીટિંગમાં કરવામાં આવે છે.